

M.Com Semester - 2 (CBCS) Examination
August/September -2020 [NEW COURSE]
Corporate Financial Reporting (CORECOURSE)

Time: 2:00 Hours

Marks: 56

Instructions:

1. Figures to the right indicate marks.
2. There are four questions in the question paper.
3. Write any one from Que.1 and Que.2
4. Que. 3 & 4 is Compulsory.

પ્રશ્ન-1 તા.31-12-2019નાં રોજનાં V લિ. અને J લિ.નાં પાકા સરવૈયા છે. તેના પરથી સમાનકદનું પત્રક બનાવી. (20)
 નાણાંકીય વિવેચન કરો.

જવાબદારીઓ	V લિ. રૂ.	J લિ. રૂ.	મિલકતો	V લિ. રૂ.	J લિ. રૂ.
ઇક્વિટી શેરમૂડી	5,00,000	8,00,000	સ્થાયી મિલકતો	2,00,000	6,00,000
પ્રેફરન્સ શેરમૂડી	2,00,000	3,00,000	ચાલુ મિલકતો	3,00,000	1,00,000
સામાન્ય અનામત	1,00,000	2,00,000	રોકાણો	82,000	60,000
નફાનુકસાન ખાતું	80,000	1,00,000	આખર સ્ટોક	50,000	2,00,000
લેણદારો	50,000	60,000	દેવાદારો	80,000	2,00,000
દેવીહૂંડી	2,000	4,000	રોકડ બેંક	2,20,000	3,04,000
	9,32,000	14,64,000		9,32,000	14,64,000

અથવા

પ્રશ્ન-1 રમેશ લિ.ની નીચેની માહિતી પરથી પાકું સરવૈયું તૈયાર કરો.

સ્ટોક ચલન દર (વેચેલ માલની પડતર/આખર માલનો સ્ટોક)	6 વખત
કાચા નફાનો ગુણોત્તર	20%
ચાલું ગુણોત્તર	2.5:1
પ્રવાહી ગુણોત્તર	1.5:1
કાર્યશીલ મૂડી	રૂ.7,50,000
કાયમી મિલકતના ઉથલાનો ગુણોત્તર (વેચેલ માલની પડતર સાથે)	2 વખત
સરેરાશ ઉઘરાણીની મુદત (વર્ષનાં 360 દિવસો)	60 દિવસ
કાયમી મિલકતો સાથે શેરહોલ્ડરોનાં ભંડોળનું પ્રમાણ	0.80:1
અનામત અને વધારા સાથે મૂડીનું પ્રમાણ	0.50:1
લાંબાગાળાની લોન સાથે શેરહોલ્ડરોનાં ભંડોળનું પ્રમાણ	0.20:1

પ્રશ્ન-2 તા.1-1-2019નાં રોજ રાજેશ કંપની લિમિટેડનું પાકું સરવૈયું અને તા.31-12-2019નાં રોજ પૂરા થતા વર્ષનું (20)
 આવકનું પત્રક નીચે મુજબ છે.

તા.1-1-2019નાં રોજનું પાકું સરવૈયું

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
શેરમૂડી	1,00,000	મશીનરી	88,000
12% ડિબેચર	20,000	સ્ટોક	12,000
લેણદારો	20,000	દેવાદારો	20,000
		રોકડ	20,000
	1,40,000		1,40,000

તા.31-12-2019નાં રોજ પૂરા થતાં વર્ષનું આવકનું પત્રક

વિગત	રૂ.	કુલ રૂ.
વેચાણ:		1,60,000
બાદ: વેચેલ માલની પડતર: શરૂ સ્ટોક (FIFO)	12,000	
ખરીદી (ચોખ્ખી)	48,000	
	60,000	
બાદ: આખર સ્ટોક (FIFO)	10,000	50,000
કાચો નફો		1,10,000
બાદ: વહીવટી ખર્ચા	24,000	
ઘસારો	8,800	
ડિબેચર વ્યાજ (તા.31-12-19નાં રોજનું ચૂકવ્યું.	2,400	35,200
ચોખ્ખી આવક		74,800

વર્ષ દરમિયાન દેવાદારો અને લેણદારોની બાકી એકસરખી રહે છે.

સામાન્ય ભાવ સૂચક આંકો:- તા.1-1-2019 280

વર્ષ દરમિયાન 350

તા.31-12-2019 420

વર્તમાન ખરીદશક્તિની પદ્ધતિ (CPP) મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-2 નીચેની માહિતીને આધારે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ (CCA) હેઠળ ગિયરિંગ હવાલાની ગણતરી કરો.

વિગત	1-4-2018 રૂ.	31-3-2019 રૂ.
રૂપાંતરિત ડિબેચરો	20,00,000	24,00,000
બેંક ઓવરડ્રાફ્ટ	12,00,000	16,00,000
રોકડ	2,00,000	6,00,000
ભરપાઈ થયેલ શેરમૂડી	30,00,000	40,00,000
અનામતો	10,00,000	16,00,000

(1) વેચાણ પડતરનો હવાલો (COSA) રૂ.4,00,000

(2) નાણાંકીય કાર્યશીલ મૂડી હવાલો (MWCA) રૂ.3,00,000

(3) ઘસારો રૂ.1,00,000

કુલ રૂ.8,00,000

પ્રશ્ન-૩ જયેશ કંપની લિમિટેડનાં નીચેના આવક ખર્ચનાં પત્રકમાંથી મુલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરો.

(18)

વર્ષ 31-3-2019નાં અંતનું; આવક ખર્ચનું પત્રક

વિગત	રૂ.	કુલ રૂ.
વેચાણ:	40,00,000	
બાદ: માલસામાનની પડતર	18,00,000	22,00,000
બાદ: (1) મજૂરી	8,00,000	
(2) ઘસારો	2,00,000	
(3) વ્યાજ	4,00,000	14,00,000
કરવેરા પહેલાનો નફો		8,00,000
બાદ: કરવેરા		4,00,000
કરવેરા બાદનો નફો		4,00,000
બાદ: ડિવિડન્ડ		2,00,000
રાખી મૂકેલ કમાણી		2,00,000

અથવા

પ્રશ્ન-૩ (અ) આર્થિક મૂલ્ય વૃદ્ધિ (EVA)નો ખ્યાલ સવિસ્તાર સમજાવો.

(09)

(બ) બજાર મૂલ્ય વૃદ્ધિ (MVA) સમજાવો.

(09)

પ્રશ્ન-૪ નાણાંકીય અહેવાલ પ્રેષણ માહિતીની ગુણવત્તાયુક્ત લાક્ષણિકતાઓ સમજાવો.

(18)

અથવા

પ્રશ્ન-૪ કંપનીલક્ષી નાણાંકીય અહેવાલ પ્રેષણનો અર્થ અને ફાયદા સમજાવો.

ENGLISH VERSION

Que-1 Criticise Financially by preparing Equal size statement. Balance Sheets of v Ltd. and J Ltd. as on 31-12-2019. (20)

Liability	V Ltd. Rs.	J Ltd. Rs.	Assets	V Ltd. Rs.	J Ltd. Rs.
Equity Share Capital	5,00,000	8,00,000	Fixed assets	2,00,000	6,00,000
Preference Share Capital	2,00,000	3,00,000	Current assets	3,00,000	1,00,000
General Reserve	1,00,000	2,00,000	Investment	82,000	60,000
Profit & Loss Account	80,000	1,00,000	Closing Stock	50,000	2,00,000
Creditors	50,000	60,000	Debtors	80,000	2,00,000
Bills Payable	2,000	4,000	Cash Bank	2,20,000	3,04,000
	9,32,000	14,64,000		9,32,000	14,64,000

OR

Que-1 Prepare balance sheet from the following Information of Ramesh Ltd.

Stock Turnover (Cost of Sales/Closing Stock)	6 Times
Gross Profit Ratio	20%
Current Ratio	2.5:1
Liquid Ratio	1.5:1
Working Capital	Rs.7,50,000
Fixed Assets Turnover Ratio (with cost of sales)	2 Times
Average Collection Period (Annual 360 days)	60 days
Proportion of share holder's fund with fixed assets	0.80:1
Proportion of capital with Reserve and Surplus	0.50:1
Proportion of shareholder's funds with along term Loan	0.20:1

Que-2 The Balance Sheet as on 1-1-2019 and Income Statement for the year ending on 31-12-2019 of Rajesh Limited are as follows. (20)

Balance Sheet as on 1-1-2019

Liabilities	Rs.	Assets	Rs.
Share Capital	1,00,000	Machinery	88,000
12% Debenture	20,000	Stock	12,000
Creditors	20,000	Debtors	20,000
		Cash	20,000
	1,40,000		1,40,000

Income Statement for the year ending 31-12-2019.

Particulars		Rs.	Total Rs.
Sales:			1,60,000
Less: Cost of Sales: Opening Stock (FIFO)		12,000	
Purchase (Net)		48,000	
		60,000	
Less: Closing Stock (FIFO)		10,000	50,000
	Gross Profit		1,10,000
Less: Administrative expenses		24,000	
Depreciation		8,800	
Debenture Interest (Paid as on 31-12-2019)		2,400	35,200
	Net Income		74,800

Balance of debtors and creditors A/c Remains Uniform throughout the year.

General Price Index were as under:

On 1-1-2019	280
For the year	350
On 31-12-2019	420

Prepare final Accounts by current purchase power method (C.P.P.)

OR

Que-2 From the data given below calculate the gearing Adjustment Required under current Cost Accounting (CCA) Method.

Particular	1-4-2018 Rs.	31-3-2019 Rs.
Convertible Debentures	20,00,000	24,00,000
Bank Overdraft	12,00,000	16,00,000
Cash	2,00,000	6,00,000
Paid up Share Capital	30,00,000	40,00,000
Reserves	10,00,000	16,00,000

(1) Cost of Sales Adjustment (COSA) Rs.4,00,000

(2) Monetary Working Capital Adjustment Rs.3,00,000

(3) Depreciation Rs.1,00,000

Total: Rs.8,00,000

Que-3 Prepare a Value-Added statement from the following Income Expenditure statement of the Jayesh Co. Ltd. (18)

Income Expenditure Statement for the year ended on 31-3-2019.

Particulars		Rs.	Total Rs.
Sales:		40,00,000	
Less: Cost of Materials		18,00,000	22,00,000
Less: (1) Wages		8,00,000	
(2) Depreciation		2,00,000	
(3) Interest		4,00,000	14,00,000
	Profit of before Taxation		8,00,000
Less: Taxation			4,00,000
	Profit after Tax		4,00,000
Less: Dividend			2,00,000
	Retained Earning		2,00,000

OR

Que-3 (A) Explain in detail about Economic Value Added (EVA) (09)

(B) Explain Market Value Added (MVA) (09)

Que-4 Explain the qualitative characteristics of Financial Reporting Information. (18)

OR

Que-4 Explain the meaning and advantages Corporate Financial Reporting.
